



NBJ-002-001204 Seat No. _____

B. Com. (Sem. II) (CBCS) Examination

April/May - 2017

Company Law : Paper - II

(Old Syllabus)

Faculty Code : 002

Subject Code : 001204

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

1 કંપની સેક્રેટરીનો અર્થ આપી સેક્રેટરીનાં ગુણો અને લાયકાતો જણાવો. 20

અથવા

1 કંપની સેક્રેટરીની ફરજો અને જવાબદારીઓનું વર્ણન કરો. 20

2 ડિરેક્ટરનો અર્થ આપી ડિરેક્ટરની વિવિધ ફરજો જણાવો. 20

અથવા

2 (અ) તફાવત સ્પષ્ટ કરો : ડિરેક્ટર વી. મેનેજિંગ ડિરેક્ટર. 10

(બ) કંપની ડિરેક્ટરની નિમણૂક અને છુટા કરવા અંગેની જોગવાઈઓ જણાવો. 10

3 (અ) વહેંચણીપાત્ર નફો એટલે શું ? વહેંચણીપાત્ર નફાને અસર કરતાં પરિબલો જણાવો. 10

(બ) નોંધ લખો : વચગાળાનું ડિવિડન્ડ. 5

અથવા

3 સભ્યો અને લેણદારો દ્વારા કંપનીને સ્વેચ્છાએ ફડયામાં લઈ જવાની વિધિ સમજાવો. 15

4 (અ) નોંધ લખો : કેડબરી કમિટીનો રિપોર્ટ. 8

(બ) તફાવત સ્પષ્ટ કરો : ફડયો વી. નાદારી. 7

અથવા

4 કોર્પોરેટ ગવર્નન્સના મૂળભૂત સિદ્ધાંતો સમજાવો. 15

ENGLISH VERSION

- 1** Give the meaning of Company Secretary and describe the Qualities and Qualifications of Company Secretary. **20**

OR

- 1** Describe duties and responsibilities of Company Secretary. **20**
- 2** Give the meaning of Directors and explain various duties of Director. **20**

OR

- 2** (a) Draw a difference between Director V/s. Managing Director. **10**
- (b) State the provisions of appointment and retirement of Director. **10**
- 3** (a) What is meant by divisible profit ? Discuss factors affecting to divisible profit. **10**
- (b) Write a note on "Interim Dividend". **5**

OR

- 3** Explain the process of voluntary winding-up-of company by Members and Creditors. **15**
- 4** (a) Write a note on "Report of Cadbury Committee". **8**
- (b) Give a difference between Liquidation Vs. Insolvency. **7**

OR

- 4** Explain the basic principles of Corporate Governance. **15**